

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રેમ્પટન મેયરના COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સની (Youth Support Task Force) જાહેરાત કરે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (20 માર્ચ 2020) – આજે સિટી ઓફ બ્રેમ્પટનને તેમનું ચોથું ફક્ત યુવાધન માટેનું વિશિષ્ટ કાર્ય દળ ઊભું કર્યાની જાહેરાત કરી છે જેથી સ્થાનિક અર્થતંત્ર અને નબળા સમાજોને ટેકો મળી શકે: મેયરનો COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ.

હરકિરત સિંઘ સિટી કાઉન્સિલર વોર્ડ 9 અને 10 અને શેરમેન વિલિયમ્સ સિટી કાઉન્સિલર, વોર્ડ 7 અને 8નાં સહ પ્રમુખપદે આ વિશેષ ટીમ બ્રેમ્પટનના યુવા નાગરિકોને આવા સમયે સૌથી વધુ આવશ્યક હોય એવી માહિતી અને સંસાધનો પહોંચાડવા અંગે સંકલન કરશે.

આ જૂથ સિટી ઓફ બ્રેમ્પટન ઈમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર અને સિટીના સ્ટાફ સાથે મળીને કામ કરશે જેઓ COVID-19ને માત આપવા માટેના અસરકારક પ્રતિભાવનું વ્યવસ્થાપન કરે છે અને આવા મુશ્કેલીભર્યા સમયમાં આપણા યુવાધનને જે સંસાધનો અને સપોર્ટની આવશ્યકતા હોય તેનું સંકલન કરશે.

ટાસ્ક ફોર્સ નીચેની બાબતો પર ધ્યાન આપશે:

1. સિટીના પુસ્તકાલયો અને રિક્રિએશન સેન્ટરો બંધ હોવાથી યુવાનોને પ્રવૃત્ત કરવા મદદરૂપ થવાની તકો
2. બાળ સંભાળ સપોર્ટ અને નિર્ભળ યુવાનો માટેના આશ્રયસ્થાનો અંગે રીજન ઓફ પીલ સાથે સંકલન કરવું
3. બ્રેમ્પટન ખાતેની યુવાનો માટેની માનસિક આરોગ્યની સંસ્થાઓ અંગેની મદદ અને માહિતીનું સંકલન કરવું
4. આપણા યુવાધનને મદદરૂપ થવા માટે સ્વયંસેવકો અને હિસ્સાધારકો માટે વધારાની પ્રવૃત્ત થવાની તકો

નાગરિકો અને કર્મચારીઓને સુરક્ષિત રાખવામાં મદદ કરવા જ્યારે સિટી હોલ બંધ છે ત્યારે આપણા સ્થાનિક અર્થતંત્ર અને આખા શહેરના યુવાધનને મદદરૂપ થવા અમે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ.

આવતી પેઢીને મદદરૂપ થવું તે એક મહત્વપૂર્ણ માર્ગ છે કે જેથી કાઉન્સિલ સિટીને ભવિષ્ય માટે સજ્જ કરી શકે.

મેયરના COVID-19 ઈકોનોમિક સપોર્ટ, સોશ્યલ સપોર્ટ, અને સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સિસનો આ સપ્તાહમાં થયેલ પ્રારંભના પગલે આજની જાહેરાત થઈ છે. આમ વિશે વધુ [અહીં](#)વાંચી શકશો.

અમારી સાથે જોડાવ

જે વ્યક્તિઓ સિટીના COVID-19 રાહત કાર્યોમાં મદદરૂપ થવા પોતાનો ફાળો આપવા તત્પર હોય તેઓ સમર્પિત ટીમ્સનો સંપર્ક ઈમેલ દ્વારા કરી શકે છે.

- મેયરનો COVID-19 ઈકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ- Covid19business@brampton.ca
- મેયરનો COVID-19 સોશ્યલ સપોર્ટ ટાસ્ક ફોર્સ- Covid19support@brampton.ca
- મેયરનો COVID-19 સિનિયર્સ સપોર્ટ ટાસ્ક ફોર્સ- Covid19seniors@brampton.ca
- મેયરનો COVID-19 યુથ સપોર્ટ ટાસ્ક ફોર્સ- Covid19youth@brampton.ca

વધુ માહિતી

સિટીની સેવાઓ અને બંધ રહેલ સવલતો અને પ્રોગ્રામિંગ વિશે બિલકુલ તાજેતરના અપડેટ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) માટે અહીં www.brampton.ca/covid19ની મુલાકાત લેવા વિનંતી છે.

પીલ પબ્લિક હેલ્થ પરથી બિલકુલ અદ્યતન માહિતી માટે મુલાકાત લો: www.peelregion.ca/coronavirus.

અવતરણ

"હાલમાં જ્યારે બ્રમ્પટનવાસીઓ અને કર્મચારીઓની સુરક્ષિત રાખવામાં મદદરૂપ થવા સિટી હોલ બંધ છે ત્યારે કાઉન્સિલે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું છે જેથી અમે બ્રમ્પટનવાસીઓ અને ખાસ કરીને યુવાનોને સહયોગ આપી શકીએ. આ નવો ટાસ્કફોર્સ સુનિશ્ચિત કરશે કે અમે બ્રમ્પટનના યુવા વર્ગને અર્થપૂર્ણ રીતે મદદ કરી રહ્યા છે, તે સુનિશ્ચિત કરશે કે તેઓ પાસે ભણવા માટે, સક્રિય રહેવા માટે અને તેમને જરૂર હોય એવી મદદ સાથે પ્રવૃત્ત અને પછી તે રિક્રિએશનના વિકલ્પો હોય માનસિક આરોગ્ય વિષયક મદદ હોય કે આશરૂસ્થાનો હોય. અમારા હિસ્સાધારકો સાથે મળીને અમે COVID-19નો પ્રભાવ યુવાધન પર ઓછામાં ઓછો રહે તે માટે પ્રતિબદ્ધ છીએ."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca